

**Super Visa/ Visitor to Canada Insurance**

Best Mortgage Rates  
1st and 2nd Mortgages  
Life and Critical Illness Insurance  
RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

**Mukund Sheth**  
Financial Advisor  
www.pyramidfinancial.ca  
Serving at 2 locations  
GTA East / GTA West ON LIC # 10530  
Investment | Insurance | Mortgages

परदेशां देशी महेंक अटले

**स्वदेश**

केनेडाथी प्रसिद्ध थतुं सर्वोत्तम गुजराती साप्ताहिक SWADESH

**FOR BUYING, SELLING & LEASING**  
Investment In Real Estate Can Make Your Future Better...

**FOR SELLERS**  
Free Home Staging Consultation  
Professional Photography & Virtual Tour  
Attractive Advertising  
Social Media Marketing  
Customized Feature Sheet  
Weekly Open House  
Assist in Mortgage & Legal Services

**FOR BUYERS**  
Team of Strong Mortgage Brokers  
Team of Lawyers  
Professional Home Inspectors  
Step by Step Guidance Through out Buying Process

**AMIT SHAH**  
Sales Representative  
Dir: 647-995-5640  
amit@stahomes@gmail.com

**KOMAL SHAH**  
Sales Representative  
Dir: 647-624-5640  
komal@stahomes@gmail.com

Homekey236@gmail.com  
Web: www.amitshah.ca

FRIDAY, 08 APRIL, 2022 Vol. 19, No. 14 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

# યુદ્ધ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની વિવિધ સમિતિઓમાં રશિયા વિરુદ્ધ 10 પ્રસ્તાવો સમયે ભારત તટસ્થ વલણ અપનાવી ગેરહાજર UN માનવાધિકાર સંસ્થામાંથી રશિયાની હકાલપટ્ટી

યુનોમાં અમેરિકાની દરખાસ્ત અંગે મતદાન થતાં રશિયા વિરુદ્ધ 93, તરફેણમાં 24 મત નોંધાયા, 58 દેશ ગેરહાજર રહ્યા



વોશિંગ્ટન

રશિયાના આક્રમણનો મક્કમતાથી સામનો કરી રહેલું યુકેન ઝુકવા માટે જરા પણ તૈયાર નહીં થતાં બંને દેશો વચ્ચે ૪૦ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આવા સમયે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાંથી રશિયાની હકાલપટ્ટી માટેનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે પસાર થયો હતો. અમેરિકાએ રજૂ કરેલી આ દરખાસ્ત પર યુએનજીએમાં ગુરુવારે મતદાન થયું હતું, જેમાં ૯૩ સભ્યોએ સમર્થનમાં, જ્યારે ૨૪ સભ્યોએ પ્રસ્તાવની વિરોધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત ૫૮ દેશોએ મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાંથી રશિયાની હકાલપટ્ટી માટે બે તૃતિયાંશ મતોની જરૂર હતી. યુકેનની રાજધાની ક્રીવના શહેર બુચ્યામાંથી રશિયન સૈન્યની પીછેહઠ પછી નાગરિકોના શબોની ભયાનક તસવીરો અને વીડિયો સામે આવતાં સમગ્ર વિશ્વમાં રશિયા વિરુદ્ધ આકોશ ફેલાયો છે. આ તસવીરોને પગલે અમેરિકાની રાજદૂત લિંડા થોમસ-ગ્રીનફિલ્ડે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાંથી રશિયાને કાઢી મૂકવા માટે યુએનજીએમાં ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.

અમેરિકા, બ્રિટન અને યુરોપીયન દેશો દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, મહાસભા અને માનવાધિકાર પરિષદમાં અલગ અલગ પ્રસંગે રશિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં ૧૦ પ્રસ્તાવ રજૂ કરાયા છે. આ બધા જ પ્રસ્તાવોમાં મતદાન સમયે ભારતે ગેરહાજર રહેવાનું વલણ જાળવી રાખ્યું છે. ભારતે યુકેન અને રશિયાના યુદ્ધમાં તટસ્થ વલણ અપનાવ્યું છે. જોકે, ભારતે બુચ્યા શહેરમાંથી સામે આવેલી નરસંહારની તસવીરો અંગે સ્વતંત્ર તપાસની માગણી કરી હતી.

બુચ્યા શહેરમાં નરસંહારની તસવીરો મુદ્દે સમગ્ર વિશ્વમાં ચારેબાજુથી ઘેરાયેલા રશિયાએ યુએનજીએમાં તેના વિરુદ્ધ મતદાન થાય તે પહેલાં કહ્યું હતું કે, બુચ્યા નરસંહાર માટે યુકેન જવાબદાર છે. આ મુદ્દે રશિયા પર મૂકાયેલા આરોપો ખોટા છે. યુકેન સામેના યુદ્ધમાં રશિયાને સમર્થન આપનારા ચીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે જણાવ્યું કે, માનવાધિકાર પરિષદમાંથી સભ્યપદ તરીકે રશિયાને આ રીતે દૂર કરવું તે એક નવું જોખમી ઉદાહરણ રજૂ કરશે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં રશિયા વિરુદ્ધ મતદાન શરૂ થાય તે પહેલાં યુકેને જણાવ્યું હતું કે યુએનએચઆરસીમાંથી સભ્ય તરીકે રશિયાની હકાલપટ્ટી કોઈ વિકલ્પ નથી. દરમિયાન યુકેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ભારત-રશિયાના સંબંધો અંગે જણાવ્યું હતું કે, ભારતનો સંબંધ સોવિયેત સંઘ સાથે હતો, રશિયા સાથે નહીં. વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુકેન માટે સુરક્ષા ગેરેન્ટર બનવાની માગણી પણ કરી છે.

## 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે

# પાક.માં સંસદ ભંગ કરવાનો ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરકાયદે : સુપ્રીમ

ઈસ્લામાબાદ

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પાંચ દિવસની સુનાવણી હાથ ધરીને ગુરુવારે સાંજે સંસદના ડેપ્યુટી સ્પીકરનો અવિશ્વાસનો પ્રસ્તાવ ગેરબંધારણીય હોવાનો નિર્ણય ખોટો હોવાનું, વડાપ્રધાન ઈમરાન ખાનની ભલામણને આધારે સંસદ ભંગ કરવાનો નિર્ણય પાકિસ્તાનના બંધારણની વિરૂદ્ધ હોવાનો ચુકાદો આપ્યો છે.



આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનની સંસદને પુનઃસ્થાપિત કરી વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો માટેનો આદેશ પણ આપ્યો છે. ૩ એપ્રિલના રોજ ડેપ્યુટી સ્પીકર દ્વારા ઈમરાન ખાન સરકાર સામે રજૂ કરવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ગેરબંધારણીય હોવાનો નિર્ણય પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની 5 જજની બેચે સર્વાનુમતે ભૂલભરેલો હોવાનું

જાહેર કર્યું છે. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય કટોકટી વધારે વિકટ બની છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ અંગે વિગતવાર ઓર્ડર જ જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે, વડાપ્રધાન ઈમરાન ખાને નેશનલ એસેમ્બલી વિખેરી નાખવા માટે કરેલી દરખાસ્ત માટે યોગ્ય કારણો નથી આપ્યા. દરમિયાન પાકિસ્તાનના એડવોકેટ જનરલ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના વકીલે હવે શું કરવું એ અંગે સુપ્રીમ કોર્ટને પોતાને દલીલો અને માર્ગદર્શન આપશે. એવી શક્યતા જોવાઈ રહી છે કે ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા થાય અથવા તો સુપ્રીમ કોર્ટની ભલામણ અનુસાર વિરોધ પક્ષને સરકાર બનાવવા માટે મોકો આપવામાં આવે. વધુમાં 9મી એપ્રિલે હવે પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે મતદાન યોજાશે.

**ABOWATH REAL ESTATE GROUP**  
VALUING REAL ESTATE OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH  
BROKER  
416-893-4585  
More info on PAGE 2  
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

**CIBC**

Mortgage advice that comes to you

For expert advice contact me today

**Dhires Shah**  
Mobile Mortgage Advisor  
Tel : 647-248-0246  
dhires.shah@cibc.com

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

**Ashok Travels 416-977-9896** અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

**www.ashoktravel.com**  
Ashok Travels Serving your travel needs in Canada since 1973  
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Residential  
New Condos  
Investments  
Commercial

દુકાનાં ચાલે સખરો

**Zakir Patel**  
Broker  
Cell: 416-561-7973  
Office: 416-287-2222

**RE/MAX COMMUNITY**  
Realty Inc., Brokerage  
Independently Owned and Operated  
1265, Morningside Ave. #203  
Toronto, ON M1B 3V9  
Email: patelzakir82@gmail.com

**SS & LAWYERS LLP**

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

**Avni Shah**  
B.A., JD  
Barrister & Solicitor  
ashah@sslawyers.ca  
Tel : 416-818-4000  
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1



# બ્રામ્પટનમાં રાશી અને નવલ બજાજના ઘરે ગણગૌર ઉત્સવની ઉજવણી

ગ્રામ્પટન

ગત રવિવાર, ૩ એપ્રિલ, ૨૦૨૨ના રોજ, રાજસ્થાન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા, કેનેડા RANA કેનેડા તરીકે જાણીતું છે, એ રાશી અને નવલ બજાજના બ્રામ્પટનના નિવાસ સ્થાને ગણગૌર ઉત્સવની ઉજવણી કરાઈ હતી. આ વર્ષે ગણગૌર પૂજા તેમના બે પ્રિય મિત્રોની યાદમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ શિક્ષણને સમર્પિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સ્તન કેન્સર સંશોધન માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. જે રકમ UHN અને વિલિયમ ઓસ્લર ફાઉન્ડેશનને એમિટી ફાઉન્ડેશન - એક સખાવતી સંસ્થા દ્વારા દાનમાં આપવામાં આવશે. અપૂર્વા શ્રીવાસ્તવ (કોન્સ્યુલેટ



કઠપૂતળીઓ, છત્રીઓ, ફ્લોરલ ફેસ્ટૂન બોર્ડર સહિતની વસ્તુઓથી રાજસ્થાની સજાવટ કરાઈ

જનરલ ઓફ ઈન્ડિયા, ટોરોન્ટો) મુખ્ય અતિથિ હતા. પ્રભમીત સિંહ સરકારિયા (ટ્રેઝર બોર્ડ, ઓન્ટારિયોના પ્રમુખ) અને રોન ચઢ્ઠા (અધ્યક્ષ, પીલ પોલીસ બોર્ડ) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ

કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ લોકોએ હાજરી આપી હતી. તમામ મહિલાઓ ભારતીય પોશાક પહેરીને હાજર રહી હતી. જેમ કે લહેંગા-ચોલી અથવા સાડી અને પુરુષો કુર્તા પાયજામા અથવા રાજસ્થાની પોશાક



પહેરીને કાર્યક્રમમાં સામેલ થયા હતા.

રાશી અને નવલ બજાજે માત્ર રાજસ્થાનના જ નહીં, પરંતુ અન્ય ભારતીય રાજ્યોના લોકોને પણ આમંત્રણ આપ્યું હતું. રંગબેરંગી ભારતીય વસ્ત્રો

અને હાથથી બનાવેલી કઠપૂતળીઓ, સુશોભન છત્રીઓ, ફ્લોરલ ફેસ્ટૂન બોર્ડર અથવા બંધનવાર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને પરંપરાગત રાજસ્થાની સજાવટ અને અન્ય ઘણી કલાકૃતિઓથી વાતાવરણ મોહક બન્યું હતું. બજાજ પરિવાર દ્વારા તમામ મહિલાઓ અને યુવતીઓને પૂજા માટે જરૂરી તમામ સામગ્રી આપવામાં આવી હતી. સૌપ્રથમ, RANA કેનેડાના પ્રેસિડેન્ટ કિસ સુરાનાએ ગેસ્ટ ઓફ ઓનર સાથે અપૂર્વા શ્રીવાસ્તવનો પરિચય કરાવ્યો હતો. શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેઓ ભારતથી દૂર તેમના વારસા અને સંસ્કૃતિને કેવી રીતે સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જોઈને તેઓ ખૂબ જ ખુશ છે.

## સ્ટંટ ડ્રાઈવિંગ કરનારા માટે સખત કાનૂન આવશે

સ્ટંટ ડ્રાઈવિંગ કરનારા ડ્રાઈવરોના લાયસંસ પણ રદ કરવામાં આવે એવી શક્યતા

ટોરોન્ટો

ઓન્ટેરિયો સરકારે જે લોકો બેફામ ડ્રાઈવિંગ કરતા હોય તેવા લોકો માટે 1લી એપ્રિલથી વધુ દંડ કરવાના સખત નિયમનો અમલ શરૂ કર્યો છે.

વાહન વ્યવહાર ખાતાના મંત્રીના કહેવા મુજબ ઓન્ટેરિયો ખાતે સ્ટંટ ડ્રાઈવિંગ કરનારાઓને અનેક વખત સજા કરવામાં આવી છે અને નવા કાયદાઓ પણ આ દુષણને કાબુમાં લેવામાં મદદરૂપ બનશે એવી આશા છે. સ્ટંટ ડ્રાઈવિંગ કરનારા ડ્રાઈવરોના લાયસંસ પણ રદ કરવામાં આવે એવી શક્યતા છે.

આવા સ્ટંટ ડ્રાઈવરોનાં નામની યાદી સરકાર દ્વારા મંજૂર કરેલી કંપનીઓ પાસેથી મેળવવામાં આવશે. પરિવહન મંત્રાલયે મીડિયાને જણાવ્યું હતું કે, આ કાયદામાં જોખમી ડ્રાઈવિંગ કરનારાઓ વિરુદ્ધ 60 દિવસમાં ચુકાદો આવી જાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. જે કોઈ વ્યક્તિ 40 કિ.મી કે તેથી વધારે ઝડપે વાહન ચલાવતી પકડાશે તો તેવા મોટરસાયકલિસ્ટને હળવી સજા કરવામાં આવશે. પરંતુ જ્યાં 80 કિમીથી સુધીની ઝડપે વાહન ચલાવનારાઓ માટે ઓન્ટેરિયોમાં સખત સજાની જોગવાઈ કરવામાં

આવી છે.

જે વિસ્તારોમાં ગતિમર્યાદા 80 કિમીથી વધુ નક્કી કરવામાં આવી હશે, એવા વિસ્તારોમાં સ્ટંટ કરનારને જેલ અને દંડની સજામાં વધારો કરવામાં આવ્યો છે. 30 દિવસ સુધી રોડ સાઈડની નીચે વાહન ચલાવનારનું લાયસંસ સસ્પેન્ડ કરવામાં આવશે તથા 14 દિવસ માટે તેનું વાહન પણ જપ્ત કરવામાં આવશે. ઓન્ટેરિયોમાં સ્ટંટ અને બેફામ ડ્રાઈવિંગ કરનારા લોકો માટે વધુમાં વધુ 10 હજાર ડોલરનાં દંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

## ખાનગી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અભિયાનમાં કેનેડિયનો પણ જોડાશે

ઓન્ટેરિયો

સંપૂર્ણપણે ખાનગી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના પ્રવાસમાં મોન્ટ્રીયલનાં બિઝનેસમેનો પણ જોડાશે. માવરિક, ઈનવેસ્ટીંગ અને ફાયનાન્સિંગ કંપનીનાં ઉદ્યોગપતિ અને સીઈઓ માર્ક પેથી આ મિશન એક્ઝિઓમ સ્પેસ, કે જે 6ઠી એપ્રિલ, 12.05 કલાકે રવાના થશે. જેનું નામ એએક્સ-1 છે, જે ફ્લોરિડાથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના થશે. જેમાં માર્ક પેથી સહિત અન્ય ત્રણ ચાલક સભ્યોની ટીમ છે, તે પણ આ ખાનગી અવકાશી કાર્યક્રમમાં જોડાશે. આ અવકાશી પ્રવાસ શરૂ થઈ રહ્યો છે, તે ખરેખર રોમાંચક ઘડી છે. તેમણે

જણાવ્યું હતું કે અવકાશમાં જવાનું સપનું હું ઘણાં વર્ષોથી જોતો હતો, તે આજે સાકાર થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે. મારા માટે આ અદભુત અને અવર્ણનીય ઘટના છે. માર્ક પેથી કેનેડાનાં અન્ય ખાનગી નાગરિકોની સાથે અવકાશયાત્રામાં જોડાશે. ત્યારે તેઓ પણ આ એક મહત્વનાં પ્રવાસનાં સાક્ષી બની રહેશે. આ પ્રવાસનો હેતુ ખાનગી ધોરણે લોકોને અવકાશયાત્રા કરાવવાનો છે. ખાનગી પ્રવાસમાં જોડાનાર પ્રથમ નાગરિક ક્યુબેનો છે, જે દાયકા અગાઉ અવકાશમાં જઈ આવ્યો છે, જ્યારે બીજો નાગરિક મોન્ટ્રીયલનો વિલિયમ સેટનર છે,

## સત્તા પર આવીશું તો ઓક્ટોબરમાં લઘુત્તમ વેતન 15.50 ડોલર કરીશું: ફોર્ડ સરકાર

ચૂંટણી જીતવા માટે ન્યુ ડેમોક્રેટસ અને લિબરલ પાર્ટીએ પણ વેતન વધારાનું વચન આપ્યું

ટોરોન્ટો

ઓન્ટેરિયોની પ્રોગ્રેસિવ કન્ઝર્વેટીવ પક્ષની સરકારે જણાવ્યું હતું કે, જો ઓક્ટોબર મહિના દરમિયાન યોજાનાર ચૂંટણીમાં અમારી જીત થશે તો લઘુત્તમ વેતનમાં 50 ટકા વધારાનું અને વચન આપીએ છીએ. લઘુત્તમ વેતન દરમાં વધારાનો અમલ થવાની ઓન્ટેરિયોના નાગરિકોને મોટી આશા છે. કારણ કે, એ મહિનામાં ચૂંટણી થવાની છે અને આશા છે કે પ્રોગ્રેસિવ કન્ઝર્વેટીવ



પાર્ટીની સરકાર આવતાં 1લી ઓક્ટોબરથી લઘુત્તમ વેતનમાં વધારો કરી પ્રતિ કલાકે 15.50 ડોલર કરવામાં આવશે.

રાજ્યનાં અન્ય રાજકીય પક્ષો પણ જો તેઓ ચૂંટાય તો લઘુત્તમ વેતનમાં વધારો કરવાના વચન આપી રહ્યા છે. વિરોધ પક્ષ ન્યુ ડેમોક્રેટસે કહ્યું હતું કે, જો તેઓ આગામી ચૂંટણીમાં વિજયી થશે તો 1લી ઓક્ટોબરથી લઘુત્તમ વેતનનો દર વધારીને પ્રતિ કલાકે 16 ડોલર કરવામાં આવશે. લિબરલ્સ પણ લોકોને લાલચ આપવામાં પાછળ નથી. તેમણે પણ જણાવ્યું હતું કે, જો 2023માં અમે જીતીશું તો વેતનનો દર 16 ડોલર પ્રતિ કલાક કરીશું.

## SHIV FINANCIAL SERVICES

Serving Community Since 2009  
Canada

BEST RATES AVAILABLE

FREE  
PERSONAL  
TAX-FILE FOR  
NEW IMMIGRANTS

SUPER VISA MEDICAL  
INSURANCE &  
VISITOR TO CANADA  
MEDICAL INSURANCE

JAGDISHBHAI SEVAK  
Insurance Broker

647-236-7620

sevak\_2007@hotmail.com • www.shivfinancialservices.ca

"PROPER INSURANCE COVERAGE IS PEACE OF MIND"

## THINKING OF BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.  
મોર્ટગેજ જોઈએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY  
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR  
SALES REPRESENTATIVE

Call us TODAY for  
all of your Real Estate  
needs and get honest,  
reliable and  
professional Service  
you can count on.

MOHAMMAD  
ABOWATH  
SALES REPRESENTATIVE

MAAZ  
ABOWATH  
BROKER - TEAM LEADER

IBRAHIM  
ABOWATH  
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX  
CROSSCOUNTRY REALTY INC.  
#SellwithABOWATH  
your Local REALTOR





તંત્રી સ્થાનેથી

# દેવાદાર શ્રીલંકામાં ભારે અરાજકતા વસ્તુ ખૂટી, જનાકોશ પરાકાષ્ટાએ

ભારતના પડોશી એવું શ્રીલંકા દેવાદાર ભાનવા સાથે જ ત્યાં કટોકટીની હાલત છે. મોંઘવારી એટલી ચરમસીમાએ છે કે, ઈંધણના ભાવ ભડકે બળી રહ્યા છે. જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછતે લોકોને જીવન દુષ્કર કરી દીધું છે, 100 રૂપિયાની એક રોટલી, ગેસના બોટલના ભાવ 4100 રૂપિયા તથા એક કપ ચાનો ભાવ 100 રૂપિયા બોલાવી રહ્યો છે. શ્રીલંકામાં સર્જાયેલી આ કટોકટીની સ્થિતિ થાળે પાડવા સરકાર અને શાસકો સદંતર નિષ્ફળ જઈ રહ્યા છે. જેને કારણે જનાકોશ પણ ભભૂકી ઉઠ્યો છે. ગુરુવારે રાત્રે 5 હજારથી લોકોએ રસ્તા ઉપર ઊતરીને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષના નિવાસ તરફ રેલી કાઢીને ચઢાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબત લોકોની પરેશાની કેટલી હદે વધી છે તેનો ચિતાર આપી રહી છે.

શ્રીલંકામાં જે દશ્ય જોવા મળ્યું, તે લગભગ દાયકા પહેલા ટ્યુનિશિયા સહિતના અખાતી આફ્રિકાના દેશોમાં જોવા મળ્યું હતું. 10 વર્ષ પહેલા આ દેશોમાં સરમુખત્યારશાહી સામે આકોશ ફાટી નીકળ્યો હતો. હવે શ્રીલંકામાં બેફામ મોંઘવારી ઉપરાંત ચીજોની અછત જેવી સમસ્યાએ સ્થિતિ સંપૂર્ણપણે વકરાવી છે. આજે ત્યાં ડીઝલનું ટીપું ય મળતું નથી. કદાચ, ભારતીય ઉપખંડના દેશોમાં આ સ્થિતિ વધતે ઓછું અંશે સરખી જેવી છે. શ્રીલંકાના શાસકોએ આંખમીંચીને જે રીતે દેશને ચલાવ્યો છે, તેને કારણે તે પાંચ વર્ષ પહેલાંથી જ આર્થિક રીતે પાયમાલ તરફ ધકેલાઈ રહ્યો હતો. આવા સમયે જ કોરોનાએ દાટ વાળ્યો. ચીન પાસે લોન લઈને શ્રીલંકાના શાસકોએ ભૂલ કરી હતી. આ કારણથી આજે 2.2 કરોડની વસ્તીવાળા આ દેશમાં લોકોને કારમી પરેશાની ભોગવવી પડી રહી છે.

જીવન જરૂરિયાતની ચીજોના ભાવ પણ લોકોને દગડા રહ્યા છે. હવે તો સ્થિતિ એ હદે વણસી છે કે, શ્રીલંકામાં જીવન જરૂરી ચીજવસ્તુઓની ભારે અછત વર્તાવા માંડી છે. શ્રીલંકાની આ સ્થિતિ માટે સરકારના અનેક પગલાં કારણભૂત છે. સરકારે તેની આવક સરભર કરવા લીધેલા પગલાથી મોંઘવારી વધુ વિકરાળ બની રહી છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન કોરોનાને કારણે વિશ્વ થંભી ગયું હતું અને તેને કારણે શ્રીલંકામાં આવતા સહેલાણીઓ લગભગ બંધ થઈ જતા ટુરીઝમ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. પરિણામે દેશની આવકને મોટો ફટકો પડ્યો છે. કુશાસન અને વધુ લોન લેવાની સરકારની નીતિને કારણે શ્રીલંકાની આર્થિક સ્થિતિ એવી થતી ગઈ કે, વિદેશી દેવાનો હમો ચુકવવા 51 અબજ ડોલર બચાવવા માટે સરકાર પાસે એક જ ઉકેલ બચ્યો હતો કે તે આયાત બંધ કરી દે.

સરકારે એ પગલું ભર્યું તો તેને કારણે બીજી મુસીબત આવી પડી. આયાતબંધ થવાને કારણે ડીઝલની અછત ઊભી થઈ અને એક સમયે પેટ્રોલ પંપ ઉપર સૈન્ય ગોઠવીને લોકોને પેટ્રોલ-ડીઝલ આપવું પડ્યું. શ્રીલંકામાં ડીઝલનો વપરાશ વધુ થાય છે, પરંતુ ડીઝલની અછતને કારણે તેની માઠી અસર અન્ય ક્ષેત્રોમાં પણ વર્તાવા માંડી. ડીઝલ હવે મળતું બંધ થયું છે, તેને કારણે પરિવહન પણ પડી ભાંગ્યું, આ સાથે જ વીજળીની સમસ્યા પણ ઊભી થઈ. ગુરુવારે જ દેશમાં 13 કલાકનો વીજળી કાપ મૂકવાની જાહેરાત

કરાઈ હતી. શ્રીલંકાના ઈતિહાસમાં આ સૌથી લાંબો વીજકાપ છે. વળી, વીજકાપને કારણે સરકારી હોસ્પિટલોમાં સર્જરી પણ બંધ કરી દેવાઈ હતી. હોસ્પિટલમાં જીવનરક્ષક દવાનો જથ્થો પણ ઓછો છે. આ સ્થિતિમાં હવે ફરીથી રાજપક્ષે સરકાર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી બેલઆઉટ પેકેજ માંગવાની નોબત આવી છે. ભારત અને ચીન પાસેથી પણ વધુ લોન માંગી છે. જો કે, આ સ્થિતિમાં હજુ શ્રીલંકા ક્યારે બહાર નીકળી શકશે એ એક મોટો પ્રશ્ન છે.

ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધી નાણાં ચૂકવશે તો પણ શ્રીલંકા વધી રહેલું વિદેશી દેવું ચૂકવી શકશે નહીં. ઓક્ટોબર સુધીમાં તો શ્રીલંકા પાસે ફક્ત 4.6 ટ્રિલીયન ડોલર જ બચશે. રાજકીય દ્રષ્ટિએ પણ શ્રીલંકામાં ડામાડોળ સ્થિતિ છે. મંગળવારે અહીં તમામ મંત્રીઓએ રાજીનામા ધરી દીધા હતા. જે બાદ રાષ્ટ્રપતિએ પોતાના નાના ભાઈને નાણાં મંત્રી પદેથી હાંકી કાઢવા સાથે વિપક્ષને સરકાર બનાવવા ઓફર સુદ્ધા મુકી દીધી હતી. જો કે, આ ઓફરને વિપક્ષે ફગાવી દીધી હતી. શ્રીલંકાની આર્થિક સ્થિતિ સાવ નબળી થઈ ગઈ છે. મોંઘવારીનો દર ગયા વર્ષે ડિસેમ્બરમાં 12.1 ટકા સુધી પહોંચી ગયો હતો. આ બધી આંકડાકીય માયાજાળમાં લોકોની પરેશાની વધી રહી છે. શ્રીલંકા ખાદ્ય પદાર્થો તથા ઈંધણની ઉણપ તેમ બંને તરફ ઝઝૂમી રહ્યું છે. ગુરુવારે રાત્રે હજારો લોકોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષના નિવાસ તરફ રેલી કાઢી હતી. એ પછી કોલંબોમાં કરફ્યુ લાદી દેવાયો હતો. પોલીસ તથા સેનાની તહેનાતી પણ વધારી દેવાઈ છે. પોલીસ સાથે લોકો અથડામણમાં ઉતર્યા હતા તેમાં 45 લોકોને ગિરફતાર કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ શ્રીલંકામાં 20 દિવસથી સરકાર સામે હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગંભીર આર્થિક સંકટને લીધે દેશવ્યાપી વિરોધને જયસૂર્યાએ જનતાને સમર્થન આપ્યું છે.

શ્રીલંકામાં રાજપક્ષે પરિવાર ખૂબ શક્તિશાળી ગણાય છે. ગોટાબાયા રાજપક્ષેના મોટા ભાઈ મહિન્દા રાજપક્ષે દેશના પ્રધાનમંત્રી છે અને તેઓ આ પહેલાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદે પણ શાસન સંભાળી ચૂક્યા છે. તેમના નાના ભાઈ બાસિલ નાણાંમંત્રી છે, તો સૌથી મોટાભાઈ ચમલ કૃષિ મંત્રી છે. જ્યારે ભત્રીજો નમલ દેશના રમતગમત મંત્રી છે. દરમિયાન ભારતે હજુ સુધીમાં ૨,૭૦,૦૦૦ મે.ટ.થી વધુ ઈંધણની શ્રીલંકાને આપૂર્તિ કરી છે. જેથી આ ટાપુ રાષ્ટ્રનું વીજળી સંકટ દૂર કરવામાં સહાય મળે. ભારતની મદદ મળ્યા બાદ ભારતને મોટાભાઈ કહેતાં ક્રીકેટ લેજન્ડ બની રહેલા શ્રીલંકાના પૂર્વક્રીકેટર સનથ જયસૂર્યાએ ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોતાના દેશને સંકટ સમયે સહાય કરવા માટે હૃદયપૂર્વકનો આભાર માન્યો હતો. જોકે, ભારતના પાડોશી બીજા દેશ પાકિસ્તાનમાં પણ અત્યારે આર્થિક સ્થિતિ કથળેલી જ છે. જેને કારણે ઈમરાન સરકારનું ભાવિ અનિશ્ચિત વર્તાઈ રહ્યું છે. ખુદ ભારતમાં પણ આજે મોંઘવારી નિરકુંશ બની રહી છે. નેપાળમાં પણ મોંઘવારીએ માઝા મુકતા લોકોની હાલત દયનીય બની છે. આવનારા દિવસોમાં ભારતીય ઉપદ્રીપ મહાખંડમાં મોંઘવારીને કારણે મોટાપાયે હિંસા ફાટી નીકળે તેવી શક્યતાને પણ હાલ નકારી શકાય તેમ નથી.

manoj1968@yahoo.ca

## DIVINE YOGA

By Geeta

### Children Yoga Class

Every Tuesday 5-6 PM

### Adult Yoga Class

Every Saturday 9-10 AM

**Join today on-ZOOM!**

**: Classes Available :**  
One to One Individual  
and Therapeutic

## Geeta Tailor

### 416-456-2261

Contact Geeta at  
divineyogabygeeta@gmail.com  
IG & FB: @divineyogabygeeta

## ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice

✓ Rat

**SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL**

✓ Cockroach

✓ Bedbug

**WE SPEAK ENGLISH, GUJARATI & HINDI**

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

**24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL**

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

**Written Guarantee And Discounted Rates**

**CALL SANKET TRIVEDI - 647.339.3926**  
Government Licensed Structural Exterminator

# જેની હત્યા માટે બે આરોપી 5 વર્ષથી નવસારી જેલમાં હતા તે શ્રમજીવી જીવતો નીકળ્યો

વેસ્માથી મળેલી લાશ નાગુલાલ ગાયરીની હોવાની પોલીસે ઓળખ કરી હતી

**નવસારી**

નવસારીનાં વેસ્મામાં 5 વર્ષ અગાઉ શ્રમજીવીની હત્યા થઈ હતી જેમાં પોલીસે બે શખ્સોને પકડીને હત્યાનાં ગુનામાં જેલમાં ધકેલી દીધા હતા. કોર્ટમાં આ કેસ શરૂ થતા જેની હત્યા થઈ હતી. તે શખ્સ કોર્ટ સમક્ષ ફિલ્મી ઢબે હાજર થતાં ચક્રાર મચી હતી.

કોર્ટે આરોપી લેખાયેલા બંને શખ્સોને નિર્દોષ જાહેર કરી પોલીસ ઈન્સ્પેક્ટરને બંને શખ્સોને દંડ પેટે રૂ.50-50 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો. મરનાર

શખ્સ જો જીવંત છે. તો હત્યા કરાયેલી લાશ કોની હતી? પોલીસની તપાસ સામે ખૂબ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. પાંચ વર્ષ અગાઉ નવસારી નજીક વેસ્મા ગામે આવેલી ને.હા.નં.48 પર ઈબ્રાહીમ દિલેરનાં ખેતરનાં શેઠા પાસે એક બિનવારસી લાશ મળી હતી.

પોલીસે આ લાશ મૂળ મધ્યપ્રદેશનાં શ્રમજીવી યુવાન કે જે આરકે સિસોદ્રા ગામે આવેલી મેજકેટ કંપનીમાં કામ કરતો નાગુલાલ કારસીંગ ગાયરીની હોવાની ઓળખ થઈ હતી. અને તેની

હત્યાના ગુનામાં તેની સાથે કંપનીમાં કામ કરતા મદન સુખલા પીપલાદી (ઉ.વ.20) અને સુરેશ ઉર્ફે નાયણ જીયાણી બાટેલા (ઉ.વ.21, બંને રહે. પલસુત જી.બડવાની મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

મરનારની લાશ પરિવારને સોંપતા તે પોતાના વતનમાં લઈ જઈ અંતિમ સંસ્કાર કરી દીધા હતા. બીજી તરફ નવસારી રૂરલ પોલીસનાં તપાસકર્તા તે સમયનાં પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપસિંહ ગોહિલે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.

# નણંદે પુરુષની જેમ પરિણીતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

**સુરત**

લીંબાયત વિસ્તારમાં પિયરમાં રહેતી 24 વર્ષીય સલમા (નામ બદલ્યું છે) ના લગ્ન આકીબ સાથે થયા હતા. સલમા પતિ, 3 દિયર, સાસુ, બે નણંદ, એક નણદોઈ, તેમના બે બાળકો સાથેના સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી. લગ્નના અઠવાડિયા બાદ નણંદ તહેસીન તેને બાહોમાં જકડી કીસ કરતી અને અડપલાં પણ કરતી હતી. આ અંગે તેણે પતિ અને સાસુને વાત કરતા તેમણે તે અંગે ધ્યાન આપ્યું નહોતું. બે મહિના બાદ રમજાન માસમાં તેની સાસુ બનારસ ગયા હતા અને મોટી નણંદ બહાર ગઈ હતી. ઘરે કોઈ નહોતું. તે સમયે તહેસીન

તેની પાસે આવી હતી અને જકડીને અંદરના રૂમમાં લઈ ગઈ હતી. રૂમમાં તહેસીન પુરુષની જેમ વર્તન કરવા લાગી હતી અને સલમાને નિઃવસ્ત્ર કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. સલમાએ તેને દૂર કરવા પ્રયાસ કર્યો તો તહેસીને ધમકી આપી હતી કે તુજે જાન સે માર દૂંગી. આ બનાવ બાદ સલમાએ પતિ અને મોટી નણંદને વાત કરતા તેમણે કહ્યું હતું કે તેના પર કોઈ પુરુષ માણસ હાવી થાય છે. જો તું આ વાત બહાર કોઈને કહેશે તો તને તલ્લાક આપી દઈશું. બે દિવસ બાદ ફરી તહેસીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ગભરાયેલી સલમાએ સાસરીયાઓને વાત કરી હતી.

# આદિવાસી અંગે ટિપ્પણી કરતાં SOUના જોઈન્ટ સીઈઓ દુબે સસ્પેન્ડ

**કેવડિયા**

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ કમિશનર અને સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના નાયબ કલેક્ટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ બાબતે ટિપ્પણી કરતા ભારે હોબાળો થયો હતો. આખરે સરકારે શિસ્ત વિશે કાર્યવાહી કરી નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા હતા. નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીનો ઓડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં હોબાળો મચ્યો હતો. નિલેશ દુબેએ CISFના અધિકારી સાથે વાતચીત કરતા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. આ સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થતા આદિવાસીઓ રોષે ભરાયા હતાં.

# પ્રેમિકાના ભાઈ અને કુવાએ બીજા માળેથી ફેંકી દેતા યુવાનનું મૃત્યુ

**સુરત**

મૂળ મધ્યપ્રદેશના મુરનાના બગીચાકાપુરા ગામનો વતની અને છેલ્લા ત્રણ મહિનાથી શહેરમાં કોસાડમાં એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરી ત્યાં જ રહેતો 25 વર્ષીય સતિષ કમલેશભાઈ કુશાહ ગત 18 માર્ચ ધુળેટીની રાત્રે આઠ વાગ્યાના અરસામાં વરાછા લંબે હનુમાન રોડ ધનશ્યામનગર શેરી નં.7 માં બેભાન મળ્યો હતો. તે બિમાર હોવાનું માની તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પણ બીજા દિવસે મળસ્કે તેનું મોત નીપજતાં વરાછા પોલીસે ગુનો નોંધી તેનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ તેના પરિવારને સોંપતા

તેઓ વતન મધ્યપ્રદેશ ગયા હતા અને ત્યાં અંતિમવિધિ કરી હતી.

અંતિમવિધિ બાદ સુરત આવેલા સતિષના પરિવારજનોને તેની સાથે કામ કરતા બે મિત્રોએ જાણ કરી હતી કે સતિષનું બિમારીને લીધે નહીં પણ તેની પ્રેમિકાના બે ભાઈ અને ફોઈ-કુવાએ બીજા માળેથી ફેંકી દેતા મોત નીપજ્યું હતું. વર્ષ 2019 માં સતિષ તેના ગામમાં જ રહેતી અને પોતાના જ સમાજની તરુણીને પ્રેમ કરતો હોય ભગાવી ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે દોઢ મહિના બાદ બંનેને પકડી સતિષને જેલ હવાલે કર્યો હતો. જ્યારે તેની પ્રેમિકાને પરિવારજનો ઘરે લઈ ગયા હતા.

# સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો ચુકાદો 16 એપ્રિલ સુધી મોકૂફ

**સુરત**

બહુચર્ચિત ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની સ્પીડી ટ્રાયલ દરમિયાન ગઈકાલે આરોપીના બચાવપક્ષની દલીલો પુરી થતાં આજે સરકારપક્ષે તેના રિપ્લાયમાં કાઉન્ટર દલીલો પુર્ણ કરતા મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે આ કેસનો સંભવિત ચુકાદો આગામી તા.16 મી એપ્રિલ સુધી મોકૂફ રાખતો નિર્દેશ આપ્યો છે. કામરેજ-પાસોદરાના ચક્રારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ અગાઉ સરકારપક્ષની દલીલો પુરી થયા બાદ બચાવપક્ષની દલીલો હાથ ધરવામાં આવી હતી. સતત ત્રણ દિવસો સુધી આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે પોલીસ તપાસમાં ક્ષતિ, પંચનામા, ગુનાના મુદ્દામાલ કબજે કરવાના મામલે આરંકા ઉઠાવી હતી.

## ગોવર્ધનજીયાળ

### સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

**Weekend Special**

રગડા પેટિસ, પાંઉભાજી,  
છોલેપુરી, કટલેસ,  
ખાસ્તા કચોરી,  
સેવ ઉસળ, સમોસા ચાટ

**Takeout & Catering**

<p>Limited થાળી (with sweet &amp; Farsan)</p> <p><b>\$9.00 +Tax</b></p>	<p>Limited થાળી (without sweet &amp; Farsan)</p> <p><b>\$7.50 +Tax</b></p>
---	--

**CATERING SPECIAL**

**\$ 14.99** 10 items  
+Tax  
Sweet, Farsan, Subji,  
Kathor, Puri, Dal, Rice  
Papad, Pickle, Kachumber

**Call us for details**

ફોન નં: **૪૧૬-૪૩૮-૦૫૪૪**  
**૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧**

**Franchise Opportunity in GTA**

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2



# અનામતનો લાભ લીધા પછી ઉમેદવાર જનરલ જગ્યા પર દાવો કરી નહીં શકે

હાઈકોર્ટે અનુસૂચિત જાતિ કેટેગરીના 122 ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી

## અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોમાં મદદનીશ કારકુનની નોકરી માટે અનુસૂચિત જાતિ કેટેગરીના 122 ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં આ ઉમેદવારોએ સામાન્ય કેટેગરીની ખાલી જગ્યાઓ માટે તેમની ઉમેદવારીને ધ્યાનમાં પર લેવા માટે કોર્ટને અરજી કરી હતી. કારણ કે જનરલ કેટેગરીમાં પસંદ થયેલા છેલ્લા ઉમેદવારો કરતાં તેમનું મેરિટ ઉચ્ચ હતું. જસ્ટિસ બિરેન વૈષ્ણવે

અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે આ SC કેટેગરીના ઉમેદવારોએ ભરતી પરીક્ષા માટે લાયક બનવા માટે વય અને અન્ય માપદંડોને લગતી છૂટછાટ મેળવી છે અને તેથી તેમને જનરલ કેટેગરીની બેઠકો માટે અનામત કેટેગરીના મેરિટ પ્રાપ્ત ઉમેદવારો ગણી શકાય નહીં. હાઈકોર્ટે નીચલી અદાલતોમાં આસિસ્ટન્ટ ક્લાર્કની ૭૬૭ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૦ માં પરપ ઉમેદવારોની પસંદગીની સૂચિ તૈયાર

કરવામાં આવ્યા પછી, ૧૨૧ બેઠકો ખાલી હતી અને અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં પણ એટલી જ બેઠકો ખાલી હતી. એસસી કેટેગરીના આ ઉમેદવારોએ ખાલી બેઠકો પર બંને કેટેગરીમાં પોતાનો દાવો કર્યો હતો, તેમણે સાથે એવી દલીલ રજૂ કરી કે અનામત કેટેગરીઓ માટે કટ-ઓફ ૬૧ ગુણ હતા જ્યારે સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે તે કટ ઓફ પર ૮૬ હતા. તેમ છતાં, સામાન્ય કેટેગરીમાં ઉમેદવારોની પૂરતી સંખ્યા ન હતી અને ૧૨૧ બેઠકો ખાલી રહી હતી.

# બાવળિયાએ ગૌચરની જમીન દબાવ્યાની સરકારને રજૂઆત

રાજગૃપ સર્વજ્ઞાતિ સેવાશક્તિની કલેક્ટર, CMને ફરિયાદ સીમના સર્વે નંબર ફેરવ્યાનો આરોપ, આંદોલનની ચીમકી

## રાજકોટ

ભાજપ શાસિત રાજ્ય સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિંછીયાના અમરાપુર, કોટડા અને વિંછીયાની સીમમાં સ્કૂલ અને સ્ટોન ક્વેર નામે ગૌચરની 200 વિંછા જેટલી જમીન દબાવી દીધાનો આક્ષેપ કરતી વધુ એક રજૂઆત સરકારને થઈ છે. જસદણના રાજગૃપ સર્વજ્ઞાતિ સેવાશક્તિ સંસ્થાએ આ કેસમાં કુંવરજીભાઈ સામે પોલીસ કેસ પણ થયો છે પરંતુ, પક્ષપલ્ટો કરી ભાજપમાં

જઈને પૂર્વ સરપંચ સાથે સમાધાન કરીને પ્રકરણ દબાવી દીધું છે. આ કેસની તટસ્થતાથી તપાસ કરીને જમીન ખાલી કરાવવા માંગણી કરાઈ છે. પૂર્વ કેબીનેટ મંત્રી અને હાલના ધારાસભ્યને અમરાપુરની સીમમાં સંકુલ માટે માત્ર 4 એકર જમીન અને ભરડીયા માટે 10 ગુંઠા જમીન મંજૂર થયેલી હતી ત્યારે હાલ સરકાર જો જમીનનો સર્વે કરાવે તો આ કૌભાંડ પ્રતિપાદિત થાય તેમ છે તેમ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર વગેરેને થયેલી રજૂઆતમાં જણાવાયું છે.

## ભાવનગરના મહિલા PSIને ધાકધમકી આપી દુષ્કર્મ કરનાર PSI રિમાન્ડ પર

ભાવનગર

ભાવનગર પોલીસ બેઠાના મહિલા અધિકારીને પ્રેમજાળમાં ફસાવી ખોટા જાસ આપી કચ્છ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પી.એસ.આઈ.એ દુષ્કર્મ આચરી મહિલા અધિકારી પાસેથી રૂપિયા ૩ લાખ અને દાગીના મેળવી લઈ ધાકધમકી આપી વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધાવા પામી હતી. જે મામલે કચ્છથી પીએસઆઈને લઈ આવી ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન આજે કોર્ટમાં રજૂ કરી તેના પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે પુછપરછ દરમિયાન દુષ્કર્મ પીએસઆઈએ મહિલા અધિકારી પાસેથી મેળવેલ દાગીના અમદાવાદમાં ગીરવે મુક્યા હોવાની કબુલાત આપતા ભાવનગર પોલીસની એક ટીમ દાગીના કબ્જે લેવા અમદાવાદ રવાના થશે.

## ધોરાજીમાં પ્રેમિકાએ જકારો આપતાં પુત્રનું અપહરણ કર્યું, આરોપી ઝબ્બે આરોપીએ બાળક સાથે ડેમમાં ઝંપલાવવાનું નિર્ધાર કર્યું હતું

રાજકોટ

ધોરાજીના સુપેડી ગામેથી ગઈકાલે મોડી સાંજે 4 વર્ષનાં બાળકનું અપહરણ થઈ જતાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી અને અન્ય પોલીસ મથકનાં સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. જો કે પોલીસે દોઢેક કલાકનાં સમયગાળામાં જ અપહરણ કરનાર દિનેશ ધનીયાભાઈ રાઠોડ (ઉ.વ.22, રહે, હાલ કોઠારીયા ગામ, રાજકોટ)ને ઝડપી લઈ તેનાં સંકળમાંથી અપહત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું હતું. આરોપી દિનેશને

અપહત બાળક રસિકની માતા સુમી સાથે પ્રેમસંબંધ હતો તે સુમીને પોતાનાં ઘરમાં બેસાડવા માંગતો હતો. પરંતુ સુમીએ ઈન્કાર કરતા તેની કાંબમાંથી રસિકને છીનવી ભાગી ગયો હતો. આ કૃત્ય કર્યા બાદ તેનો ઈરાદો આજીવનમાં રસિક સાથે ઝંપલાવી આત્મહત્યા કરવાનો હતો. પરંતુ પોલીસે સમયસર તેને ઝડપી લેતાં તેનો ઈરાદો બર આવ્યો ન હતો. મૂળ મધ્યપ્રદેશનાં અલીરાજપુરની વતની સુમી હાલ ઉપલેટાનાં મોટી વાવડી ગામે કિરીટ જાવીયાની વાડીએ રહે છે.

## ઉપલેટામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજતતુલા, 1.15 કરોડનું ફંડ એકત્રિત

ઉપલેટા

ઉપલેટા ગોકુલ ગો-સદન અરની તથા વૃક્ષ પ્રેમ ટ્રસ્ટ દ્વારા રજતતુલા સમારોહનું આયોજન કરાયું હતું. આ રજતતુલામાં CM ભૂપેન્દ્ર પટેલની 95 કિલો ચાંદીથી રજત તુલા કરાઈ હતી અને આ ચાંદીની કિંમતથી ઉપલેટા વિસ્તારના રેમો, જળાશયો, ચેકડેમો સહિતના જળસંચય સમારકામ તેમજ બનાવવામાં ઉપયોગ લેવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન આપતા કહ્યું હતું કે પાણી બચાવવું જરૂરી છે તેમજ પાણી અને વૃક્ષો એ આપડા જીવન સાથે સંકળાયેલા છે. જેને સાચવવું ખૂબ જ જરૂરી છે.

# THANK YOU FRONTLINE WORKERS



**MORTGAGE DILIGENT**  
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

**5 Yrs Fixed @ 1.84%\* High Ratio Only**  
**5 Yrs Variable @ 1.15%\* High Ratio Only**  
**3 Yrs Variable @ 0.99%\* (Special Promotion)**



Rakesh Patel\*\*  
Vice President- Commercial.



Rajesh Khurana, MBA  
Principal Broker

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Cell : 416-616-1300









## કહાની ગમે તો જ કામ કડું છું : વિદ્યા બાલન

વિદ્યા બાલને ઇન્ડસ્ટ્રી સફળતા મેળવવા ખુબ જ સંઘર્ષ કર્યો છે. તેણે અભિનયની શરૂઆત ૨૦૦૩માં બંગાલી ફિલ્મથી કરી હતી. હિન્દીમાં તેની પહેલી ફિલ્મ પરિણિતા ૨૦૦૫માં આવી હતી. એ પછી પણ તેણે અહિં સફળતા માટે સંઘર્ષ કર્યો હતો. આજે તે ખુબ સફળ અભિનેત્રી છે અને ઈચ્છા મુજબની ફિલ્મો જ કરી રહી છે. ગયા વર્ષે તેની શેરની ડિજિટલ પ્લોટફોર્મ પર આવી હતી. વિદ્યા સ્પષ્ટ કહે છે કે હું સમાજમાં બદલાવ લાવવા માટે કોઈ ફિલ્મમાં કામ કરતી નથી. મને જે કહાની ગમે છે તેમાં કામ કરી મારી જાતને વ્યસ્ત રાખુ છું.

09



# સ્પર્શ

FRIDAY, 08 APRIL, 2022

## કુવૈત સરકારે તામિલ સુપરસ્ટાર વિજય થલપથિની ફિલ્મ બિસ્ટ પર પ્રતિબંધ મૂક્યો




તામિલ સુપર સ્ટાર વિજયની નવી ફિલ્મ બિસ્ટ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ મોટા પડદા પર આવે તે પહેલાં જ ફેન્સમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુવૈતથી મળતાં સમાચાર મુજબ કુવૈતમાં આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ લાગ્યો છે. ફિલ્મનું નિર્દેશન નેલ્સન દિલીપકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં વિજય મુખ્ય ભૂમિકામાં કામ કર્યું છે અને આ એક હાસ્ય ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં કથિક રીતે મુસ્લિમ પાત્રોને આતંકવાદીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેનો કુવૈત સરકારે જબરદસ્ત વિરોધ કર્યો છે અને તેના કારણે ત્યાં બિસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

## પત્રકાર સાથે ગેરવર્તણૂક મામલે સલમાનને હાઇકોર્ટ રાહત આપી



સલમાન ખાનને પત્રકાર સાથે ગેરવર્તણૂક કરવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ગુરુવારે આ મામલાની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાન અને તેના બોડીગાર્ડ નવાઝ શેખ વિરુદ્ધ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા સમન્સ પર રોક લગાવી દીધી છે. જણાવી દઈએ કે પત્રકાર અશોક પાંડેની ફરિયાદ બાગ અંધેરી કોર્ટે 22 માર્ચે સલમાન ખાન અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ સમન્સ જાહેર કરીને 5 એપ્રિલે કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. જોકે તે પહેલાં પણ સલમાન ખાને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ હાઈકોર્ટે હવે સલમાન ખાનને 5 મે સુધી રાહત આપી છે.

## અલ્લુ અર્જુનને ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ દંડ ભરવો પડ્યો



તાજેતરમાં જ અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મની સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ ફિલ્મમાં તેના અભિનય અને એક્શનની ચોમેર પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન તે કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો હોવાનું સામે આવ્યું છે. અલ્લુ અર્જુન સામે ટ્રાફિકના નિયમો તોડવાનો આરોપ લગાવાયો છે અને હેદરાબાદ ટ્રાફિક પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુનને તાજેતરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ દંડ ભરવો પડ્યો હતો. તેની રેન્જ રોવર લક્ઝરી એસયુવીમાં ટીન્ટેડ ગ્લાસ હોવાથી હેદરાબાદ પોલીસે તેને દંડ ફટકાર્યો હતો. અલ્લુ અર્જુનને 700 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.

## Grammys 2022 : ઈન્ડિયન અમેરિકન સિંગર ફાલ્ગુની શાહ, મ્યુઝિશિયન રિકીને પુરસ્કાર

### રિકી કેજને 'Devine Tides' માટે સ્ટીવર્ટ કોપલૅંડ સાથે એવોર્ડ મળ્યો

નવી દિલ્હી: અમેરિકાના લાસ વેગાસ ખાતે એમજીએમ ગ્રાન્ડ ગાર્ડન એરીનામાં મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ શો ગ્રેમી એવોર્ડ્સ 2022 યોજાયો હતો. ભારતીય મ્યુઝિક કમ્પોઝર રિકી કેજને બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં પોતાનો બીજો ગ્રેમી પુરસ્કાર મળ્યો છે. તેમને 'Devine Tides' માટે સ્ટીવર્ટ કોપલૅંડ સાથે આ એવોર્ડ મળ્યો છે. રિકીએ સ્ટેજ પર એવોર્ડ સ્વીકારતી વખતે 'નમસ્તે' દ્વારા અભિવાદન કર્યું હતું. રિકીએ સ્ટીવર્ટ સાથેનો ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'મહાન શખ્સીયત સાથે ઉભા રહેવામાં કૃતજ્ઞતા અને પ્રેમનો અનુભવ થઈ રહ્યો

છે. અમેરિકામાં જન્મેલા પરંતુ બેંગલુરુમાં રહેતા રિકીને વર્ષ 2015માં પોતાના આલ્બમ 'વિંડ્સ ઓફ સમસરા' માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં પોતાનો પ્રથમ ગ્રેમી પુરસ્કાર મળ્યો હતો. ભારતીય અમેરિકી ગાયક ફાલ્ગુની શાહને પણ બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. ફાલ્ગુનીને 'અ કલરફુલ વર્લ્ડ' આલ્બમ માટે સન્માનિત કરવામાં આવી છે.



## ઓલિવિયા રોડ્રિગોએ ભૂલથી પોતાનો ગ્રેમી એવોર્ડ તોડી દીધો

શો બાદ ગ્રેમી નાઈટનો અણુભ અંત થઈ ગયો, જ્યાં 19 વર્ષીય ગાયિકાએ ત્રણેય એવોર્ડની સાથે પોઝ આપવાનો પ્રયત્ન કરતા ભૂલથી પોતાની એક ટ્રોફી પાડી દીધી. એવોર્ડ તૂટ્યા બાદ ગાયિકા થોડી હેરાન અને શરમ અનુભવી રહી હતી પરંતુ

તે ખૂબ ચિંતિત લાગી રહી નહોતી, કેમ કે તેની પાસે હજુ બે એવોર્ડ હતા. આ જે પણ ટ્રોફી છે, તેને કદાચ એક સાથે ખોડવાની જરૂર પડશે, કેમ કે આ નિશ્ચિત રીતે એકવાર જમીન પર પડ્યા બાદ અડધી થઈ ગઈ.

- પોપ આલબમ: સોર - ઓલિવિયા રોડ્રિગો
- આર એન્ડ બી આલબમ: હેક્સ ટેલ્સ - જેજમાઇન સલવિન
- ટેપ પર્ફોર્મન્સ: ફેમિલી ટાઇમ બેબી કીમ
- ન્યૂ આર્ટિસ્ટ: ઓલિવિયા રોડ્રિગો
- કન્ટ્રી આલબમ: ફેમિલી ટાઇમ - ક્રિસ્ટિન સ્ટેપલ્ટોન
- સોંગ ઓફ ધ યર: લીવ ઇ ડોર ઓપન
- પ્રોડ્યુસર ઓફ ધ યર (નોન કલાસિકલ): જેક એન્ડોનોફ
- ટ્રેન્ડિંગલ પોપ વોકલ આલબમ: લવ ફેર સેલ - ટોની બેનેટ તથા લેડી ગાગા
- પોપ સોલો પર્ફોર્મન્સ: ડ્રાઇવર્સ લાઇસન્સ - ઓલિવિયા રોડ્રિગો
- કોમેડી આલબમ: સિન્સિલી લૂઇસ - સી કે લૂઇસ સીકે
- ચિલ્ડ્રન મ્યુઝિક આલબમ: અ કલરફુલ વર્લ્ડ - ફલુ શાહ
- જેઝ લોકલ આલબમ: સોંગરાઇટ્સ એપોથેકરી લેબ - ઇન્સ્ટ્રેન્જા સ્પેલ્ડિંગ
- ટેપ આલબમ: કોલ મી ઇફ યૂ ગેટ લોસ - ટેલર
- ટેપ સોંગ: જેલ ● મેલોડિક ટેપ પર્ફોર્મન્સ: હરિકેન
- રોક આલબમ: મેડિસિન એટ મિડનાઇટ
- રોક સોંગ: વેઇટિંગ ઓન અ વોર
- મેટલ પર્ફોર્મન્સ: ઇ એલિયન ડ્રીમ થિયેટર
- રોક પર્ફોર્મન્સ: મેકિંગ અ ફચર - ફૂ ફઇટર્સ
- બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ: મહોબ્બત - અરોઝ આફતાબ
- બેસ્ટ ન્યૂ એજ આલબમ: રિકી કેજ

## દીપિકા ટાઇમ મેગેઝિન દ્વારા બે વખત સન્માનિત થનારી પ્રથમ ભારતીય



મુંબઈ : સાલ ૨૦૨૨ના ટાઇમ ૧૦૦ ઇમ્પેક્ટએવોર્ડની યાદીમાં દીપિકા પદુકોણનું નામ ઘણી જાણીતી વ્યક્તિઓ સાથે સામેલ છે. જેમાં વિપાનિકોથી લઈને સીઈઓ, આર્ટિસ્ટ, એક્ટિવિસ્ટ પોપ સ્ટાર્સ, રાજકારણીઓ વગેરે સામેલ છે. આ લીડરો પોતાના સતત પ્રયાસો દ્વારા પોતાની ઈન્ડસ્ટ્રી અને દુનિયાના ભવિષ્ય ખાતિર અસાધારણ કાર્યો કર્યા છે. રસપ્રદવાત તો એ છે કે, સાલ ૨૦૧૮માં સુપરસ્ટાર ટાઇમની દુનિયાના સૌથી વધુ ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં દીપિકા પદુકોણનું નામ સામેલ હતું. દીપિકા ટાઇમ મેગેઝિન દ્વારા બે વખત સન્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. સહુ કોઈ જાણે છે કે, દીપિકા પદુકોણ માનસિક તાણનો ભોગ બની હતી. તેણે પોતાના આ અંગત અનુભવનો સહારો લઈને સાલ ૨૦૧૫માં લિવ લવ લાફ નામના ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

## વિભૂતિ ઠાકુર સાઈબર બુલિંગનો ભોગ બની



હાલમાં જ ટીવી એક્ટ્રેસ વિભૂતિ ઠાકુર સાઈબર બુલિંગનો ભોગ બની હતી. વિભૂતિ ઠાકુરનો નંબર લીક થતા તેને સેક્સ્યુઅલ ફેવરના ફોનને મેસેજ આવવા લાગ્યા હતા. વિભૂતિનો નંબર ઓનલાઈન લીક થયો હતો. ત્યારબાદ તેને અનેક અજાણ્યા લોકો હેરાન કરવા લાગ્યા હતા. આટલું જ નહીં, તેની પાસે સેક્સ્યુઅલ ડિમાન્ડ કરી હતી. ભદ્રા, અશ્લીલ મેસેજ પણ આવતા હતા. અચાનક આ રીતની ઘટના બનતા તેને પહેલા કંઈજ ખબર પડતી નહોતી. પછી તેને ખ્યાલ આવ્યો કે એક સોશિયલ મીડિયા પેજમાં તેનો નંબર લીક કરવામાં આવ્યો હતો. પછી તેણે સાઈબર સેલમાં ફરિયાદ કરી હતી.

## રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એપ્રિલના બીજા વીકમાં લગ્ન કરશે

રણબીર આલિયાના લગ્ન 2022ના એપ્રિલમાં થવાની ચર્ચાઓ વચ્ચે હવે કપૂર ફેમિલીના નજીકના વર્તુળોમાંથી લગ્નની તારીખના સમાચારો આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રણબીર અને આલિયા એપ્રિલના બીજા વીકમાં લગ્ન કરશે. આ માટેનું કારણ એવું છે કે આલિયાના નાનાની તબિયત ખરાબ છે અને તેમણે આલિયા અને તેની ફેમિલી સમક્ષ એવી ઈચ્છા વ્યક્ત



કરી છે કે તે તેના લગ્ન જોવા માંગે છે જેના કારણે હવે એપ્રિલના બીજા વીકમાં લગ્ન થવાની શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રણબીર અને આલિયા 17 એપ્રિલે લગ્ન કરી શકે છે. લગ્નનું સ્થળ એન્સ્ટરલ હાઉસ RKમાં થશે. RK હાઉસમાં રણબીરના માતા-પિતાના લગ્ન થયાં હોવાથી આ સ્થળ વેડિંગ વેન્યૂ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.



# ॥ संस्कृति ॥

હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્ટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

[www.swadesh.news](http://www.swadesh.news)

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

[info@swadesh.news](mailto:info@swadesh.news)

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



## આરઆરઆર ફિલ્મમાં જોરદાર સ્ક્રીપ્ટ અને એક્શન સીક્વન્સ પર દર્શકો ફીદા થઈ ગયા

# 'પુષ્પા' બાદ હવે RRR: સાઉથની ફિલ્મોનો ડંકો

ભારતમાં હવે બોલીવુડ અને હોલીવુડ સામે દક્ષિણ ભારતમાં બનતી પ્રાદેશિક ફિલ્મોનો કેજ વધી રહ્યો છે. સામાન્ય રીતે પ્રાદેશિક ભાષામાં બનતી ફિલ્મોનું ઘણું સમયથી હિંદીમાં રૂપાંતરણ કરીને દેશની ટીવી ચેનલો પર પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. 'પુષ્પા: ધ રાઈઝ'ના કારણે અલ્લુ અર્જુન ભારતીય દર્શકોમાં છવાઈ ગયો અને રશ્મિકા મંદાના નેશનલ કુશ બની ગઈ. હવે સાઉથના બે સુપરસ્ટાર રામચરણ તેજા અને એનટીઆર જુનિયરની 'ઈઈઈ' ફિલ્મ પણ ધૂમ મચાવી રહી છે. 'પુષ્પા'થી સાવ અલગ પ્રકારની ફિલ્મ હોવા છતાં 'ઈઈઈ'એ 14 દિવસમાં જ 1000 કરોડ રૂપિયાની કમાણી કરીને છવાઈ ગઈ છે. ભારતમાં હમણાં 'પુષ્પા: ધ રાઈઝ' અને 'આરઆરઆર: રૂઢ, રણ, રૂઢિર' એ બે સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'પુષ્પા: ધ રાઈઝ' ૧૭ ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે રીલીઝ થઈ હતી. આજે ચાર મહિના પછી પણ લોકોમાં તેનો કેજ ઘટ્યો નથી. ચાર મહિનામાં આ ફિલ્મે ૪૦૦ કરોડની કમાણી કરી નાંખી છે. હજુ 'મૈં ઝૂકેગા નહીં, સાલા'વાળો 'પુષ્પા' અડીબમ છે એ જોતાં ફિલ્મ સાડા ચાર સો કરોડની કમાણી રમતા રમતાં કરી નાંખશે તે નક્કી છે. સુકુમાર નિર્દેશિત ફિલ્મ મૂળ તેલુગુમાં બની છે. પણ હિન્દી દર્શકોને પણ આ ફિલ્મે પાગલ કરી દીધા છે. દેશના યુવાનો અલ્લુ અર્જુનના લૂક અને ચાલવાની સ્ટાઈલની કોપી કરી રહ્યા છે. સાઉથની ડબ કરેલી ફિલ્મોમાં હિન્દીમાં બહુ નથી ચાલતી પણ આ ફિલ્મના હિન્દી વર્ઝને દોઢસો કરોડથી વધારે કમાણી કરી નાંખી છે. 'પુષ્પા: ધ રાઈઝ'નો કેજ શમે એ પહેલાં તો સાઉથના બે બીજા સુપરસ્ટાર રામચરણ તેજા અને એનટીઆર જુનિયરની 'આરઆરઆર' આજથી 12 દિવસ પહેલાં રીલીઝ થઈ. રૂઢ, રણ, રૂઢિર એટલે કે આરઆરઆર ફિલ્મ 'પુષ્પા' કરતાં સાવ અલગ જ પ્રકારની છે. આમ છતાં તેણે કમાણી કરવામાં 'આરઆરઆર'એ 'પુષ્પા'ને પાછળ છોડી દીધી છે. 'આરઆરઆર' હજુ દસ દિવસ પહેલાં જ એટલે કે ૨૫ માર્ચે રીલીઝ થઈ અને 12 દાડામાં તો ફિલ્મે ૮૦૦ કરોડની કમાણી કરી લીધી છે. 'પુષ્પા'ની જેમ 'આરઆરઆર'એ પણ ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરીને હિન્દી પટ્ટામાં છાકો પાડી દીધો છે. 'આરઆરઆર' જોરદાર કમાણી કરશે એવું સૌને લાગતું હતું. કેમ કે, આ 'બાહુબલિ' જેવી બ્લોક બસ્ટર ફિલ્મ આપનારા એસ. રાજામૌલિની ફિલ્મ છે. પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રમયાની 'બાહુબલિ' બે ભાગમાં બનેલી ફિલ્મે ૨૩૦૦ કરોડ રૂપિયાની



વર્લ્ડવાઈડ કમાણી કરીને બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાંખ્યા હતા. 'આરઆરઆર' એક જ ભાગમાં બનેલી છે પણ જે રીતે બોક્સ ઓફિસ પર તેનો ડંકો વાગી રહ્યો છે.

રાજામૌલિ 'બાહુબલિ'માં પ્રશ્નકોને અલગ જ દુનિયામાં લઈ ગયા હતા. સદીઓ પહેલાંના કાલ્પનિક માહિષ્મતી રાજ્યની ગાદી કબજે કરવા ખેલાતા દાવપેચ અને બદલાની કથાને રાજામૌલિએ વીએફએક્સની મદદથી એ રીતે રજૂ કરી હતી કે, દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયાં હતા. બાકી હતું તે પહેલા ભાગના અંતે બાહુબલિના વફાદાર કટપ્પા દ્વારા જ તેની હત્યાનો સીન મૂકીને રાજામૌલિએ જબરદસ્ત સસ્પેન્સ ઉભું કરી દીધું હતું. 'બાહુબલિ'નો પહેલા પાર્ટ રીલીઝ થયા પછી આખા દેશમાં એક જ સવાલ પૂછાતો હતો કે, કટપ્પાને બાહુબલિ કો ક્યું મારા ? આ સવાલનો જવાબ ફિલ્મના બીજા ભાગમાં હતો, તેથી ફિલ્મનો બીજો ભાગ જોવા લોકો ઉમટી પડ્યાં. 'બાહુબલિ'ના બીજા ભાગે

**પ્રાસંગિક**  
**ધવલ શુક્લ**

'પુષ્પા'થી સાવ અલગ પ્રકારની ફિલ્મ હોવા છતાં 'RRR'એ 12 દિવસમાં જ 1000 કરોડની કમાણી કરી, રામા રાજુ બનતો રામચરણ તેજા અને ભીમ બનતો એનટીઆર જોરદાર પરફોર્મન્સ આપીને છવાઈ ગયા

પહેલા ભાગ કરતાં પણ જોરદાર કમાણી કરીને 'બાહુબલિ'ને ઓલ ટાઈમ ગ્રેટ મૂવી બનાવી દીધી. રાજામૌલિએ 'આરઆરઆર'માં પોતાની માસ્ટરી છે એવી વીએફએક્સની કમાલ તો બતાવી જ છે, પણ લોકો 'આરઆરઆર' પર ફિદા તેની જોરદાર સ્ક્રીપ્ટ અને એક્શન સીક્વન્સ પર છે. રામા રાજુ બનતો રામચરણ તેજા અને ભીમ

બનતો એનટીઆર જોરદાર પરફોર્મન્સ આપીને છવાઈ ગયા છે. 'આરઆરઆર'નું મ્યુઝિક 'પુષ્પા' જેવું છવાઈ ગયું નથી પણ ફિલ્મની સ્ટોરીમાં એવા દબરદસ્ત ચઢાવઉતાર છે કે, ત્રણ કલાકની ફિલ્મ હોવા છતાં લોકો બોર થતા નથી. 'પુષ્પા' અને 'આરઆરઆર'ની જબરદસ્ત સફળતાએ તે બાબતનો સંકેત આપી દીધો છે કે ભારતમાં હવે દક્ષિણની ફિલ્મોનો દબદબો વધી રહ્યો છે.

છેલ્લાં દશેક વરસમાં આખો દેશ જેની પાછળ પાગલ થયો હોય એવી ફિલ્મોની વાત કરશો તો સાઉથની ફિલ્મોના નામ જ લેવા પડે તેમ છે. છેલ્લાં પાંચ-સાત વરસમાં જ દર વરસે સાઉથની એવી મોટી ફિલ્મ આવી છે કે જે આખા દેશમાં છવાઈ ગઈ છે. 'બાહુબલિ' ૨૦૧૫માં આવી પછી ૨૦૧૬માં રજનીકાન્તની કબાલી આવેલી. ૨૦૧૭માં 'બાહુબલિ'નો બીજો ભાગ આવ્યો તો ૨૦૧૮માં કોલ્લમ ગોલ્ડ માર્ફિન્સ એટલે કે સોનાની ખાણો પરની ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાનું બેકગ્રાઉન્ડ ધરાવતી કન્નડ સ્ટાર યશની

હતો. ૧૯૭૦ના દાયકામાં શોલે, ૧૯૮૦ના દાયકામાં લવ સ્ટોરી, મૈને પ્યાર ક્રિયા, ૧૯૯૦ના દાયકામાં હમ આપ કે હૈં કૌન, બોર્ડર, કુછ કુછ હોતા હે, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે વગેરે એવી ફિલ્મો આવી હતી કે, જેમનો નેશનલ કેજ ઉભો થયો હતો. ૨૦૦૦ના દાયકામાં સમ્રી દેઓલની ગદર ફિલ્મે પણ આવો કેજ ઉભો કર્યો હતો. હવે સાઉથની ફિલ્મો એ જ પ્રકારે ભારતીય દર્શકોની પસંદગીને પાત્ર બની રહી છે. આ બહુ મોટું પરિવર્તન છે અને તેનું કારણ સાઉથની ફિલ્મોની જોરદાર ક્યોલિટી છે. સાઉથની તમામ નહીં પણ મોટાભાગની ફિલ્મોમાં સ્ક્રીપ્ટથી માંડીને સ્ટાઈલ સુધીની બધી બાબતો પર જોરદાર ધ્યાન અપાય છે. ટેકનોલોજીનો જબરદસ્ત ઉપયોગ, લોકોને ખુશ કરી દે એવું મ્યુઝિક, એકદમ નવાં જ કહેવાય એવા બેકગ્રાઉન્ડ વગેરે દ્વારા સાઉથના સર્જકો દર્શકોને આશ્ચર્યચકિત થઈ જવાય એવી દુનિયામાં લઈ જાય છે. હિન્દી ફિલ્મો તેમની સરખામણીમાં બિબાંઢાળ છે. સાઉથના સુપરસ્ટાર્સ દરેક ફિલ્મ માટે નવી નવી સ્ટાઈલ, નવા લૂક લઈ આવે છે. તેની સામે બોલીવુડના કહેવાતા સુપરસ્ટાર્સ વરસોથી એક જ ઘસાઈ ગયેલી સ્ટાઈલ્સ માર્યા કરે છે, તેથી લોકોને નવું કશું મળતું જ નથી. હિન્દી ફિલ્મોની નરસી બાજુ એ છે કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી નકલખોર છે અને તેની પાસે પોતાનું કહેવાય એવું કશું નથી. નાના બજેટની કેટલીક ફિલ્મો સારી બને છે પણ સાઉથમાં જે રીતે મોટા ફલક પર બિલકુલ અલગ પ્રકારની ફિલ્મો બનાવાય છે એવું કશું હિન્દી ફિલ્મો પાસે નથી. 'પુષ્પા' અને 'આરઆરઆર'ને હિન્દી પટ્ટામાં જ ધાંચ ધાંચ સફળતા મળી છે ત્યારે આ જ ગાળામાં આવેલી હિન્દી ફિલ્મોના કહેવાતા સુપરસ્ટાર્સની ફિલ્મો ખરાબ રીતે પછડાઈ છે. એક માત્ર 'કાશ્મીર ફાઈલ્સ' ઝીંક ઝીલી રહી છે. 'કાશ્મીર ફાઈલ્સ'ની કમાણી ૩૦૦ કરોડની આસપાસ છે. 'પુષ્પા' અને 'આરઆરઆર'ની કમાણીની સરખામણીમાં 'કાશ્મીર ફાઈલ્સ' પણ પાછળ છે. પણ હિંદુવના કારણે 'કાશ્મીર ફાઈલ્સ'નો દેખાવ શાનદાર છે, તેમાં ભેમત નથી. 'કાશ્મીર ફાઈલ્સ' સિવાય આ ગાળામાં આવેલી સલમાન ખાનની અંતિમ, સૈફ અલી ખાન-રાની મુખરજીની બંટી ઔર બબલી ટુ, અમિતાભ બચ્ચનની ઝુંડ, અક્ષય કુમારની બચ્ચન પાંડે સહિતની ફિલ્મો તેના અર્થ જેટલો વકરો પણ નથી કરી શકી. ગંગુબાઈ કાઠિયાવાડી ૨૦૦ કરોડની આસપાસ વકરો કરી શકી પણ તેનું બજેટ ૧૮૦ કરોડ હતું. એટલે ગંગુબાઈ કાઠિયાવાડીને પણ સુપર હીટમાં ગણવા સામે શંકા ઉપજે તેમ છે.



જાણીતી સમાચારોને વાચા આપતું પોલીકું અખબાર  
ગુજરાત



વીકલી  
Gujarat Weekly Community Newspaper

LALIT THAKAR 647-607-4802

# Sri Radha Krishna Temple

(The Canadian Hindu Mission Centre Scarborough (Registered Charity))

1960 Ellesmere Road Unit 9 Scarborough Ontario M1H 2V9 Tel: 416-431-3311

Sri Radha Krishna Temple Charity Event Organised by Nilesh Mithaiwala 647-302-0065



**\$10**  
per person  
with light food

## RAAS GARBA

### LIVE PROGRAM

# Saturday April 09, 2022 8pm Sharp

Place: 1960 Ellesmere Road Unit 9, Scarborough ON M1H 2V9



RANA KARANSINH  
Singer-Guest Artist



BHARTI DARJI  
Singer



MEHUL JOSHI  
(Rhythem)



RENISON MACWAN  
(Keyboard)



VINOD PATEL  
(Rhythem)

For Tickets please contact:

**Mihir Bhatt + 1 416-575-1277**  
Continental Motors

**Purvin Patel 1-647-407-9866**  
**Atul Shah - 416-845-3408**

PROUD SUPPORTERS:

LALABHAI PATEL  
647-894-9609



PURVIN PATEL  
647-407-9866



ASWIN AMIN  
416-887-7264



TUSHAR SHAH  
416-828-6459



JAYESH PATEL  
416-875-7876



IMRAN  
416-854-0419



MUKHI PATEL  
647-390-0506

OUR MEDIA SUPPORTERS















# રસાકસી બાદ લખનઉએ દિલ્હીને છ વિકેટે પરાજય આપ્યો

દિલ્હીના 3/149 સામે લખનઉના 19.4 ઓવરમાં 155 રન

મુંબઈ

ઓપનર કિવન્ટન ડી કોકની આકર્ષક અડધી સદી વડે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે અહીં રમાયેલી આઈપીએલની લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને છ વિકેટે પરાજય આપ્યો હતો. લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

દિલ્હીની ટીમે પૃથ્વી શોની અડધી સદી વડે ત્રણ વિકેટે ૧૪૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં લખનઉની ટીમે ૧૯.૪ ઓવરમાં ચાર વિકેટે ૧૫૫ રન બનાવીને વિજય

હાંસલ કરી લીધો હતો.

બેટિંગ માટે આસાન જણાતી પિચ ઉપર લખનઉની ટીમ માટે સુકાની લોકેશ રાહુલ (૨૪) અને ડી કોકે પ્રથમ વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી નોંધાવીને રનચેઝની સારી શરૂઆત કરી હતી. ઈવિન લુઈસ માત્ર પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

દિલ્હીના પેસ બોલર એનરિચ નોર્લેએ બે વખત બોડીલાઈન બોલ નાખતાં તેને ક્રિસ અમ્પાયરે બોલિંગમાંથી હટાવી લીધો હતો અને તેને વોરુનિંગ પણ આપી હતી. ડી કોકે પર બોલમાં નવ



મુંબઈને હરાવીને કોલકાતા પોઈન્ટ ટેબલમાં ટોચ પર

પૂણે: કમિન્સે માત્ર ૧૪ બોલમાં અડધી સદી સાથે આઈપીએલના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદીના રેકોર્ડની બરોબરી કરતાં ૧૫ બોલમાં અણનમ ૫૬ રન નોંધાવીને કોલકાતા નાઈટ રાઈડર્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટથી વિજય અપાવ્યો હતો. કમિન્સ અને વેંકટેશ ઐયર વચ્ચે ૧૮ બોલમાં ૬૧ રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી. જ્યારે મુંબઈના સેંસે ઈનિંગની ૧૬મી ઓવરમાં ૩૫ રન આપ્યા હતા.

લખનઉનો આખરી ઓવરમાં હૈદરાબાદ સામે ૧૨ રનથી વિજય

મુંબઈ: હોલ્ડરે આખરી ઓવરના તનાવ વચ્ચે શાનદાર દેખાવ કરતાં માત્ર ૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપતાં લખનઉ સુપર જાયન્ટ્સે હૈદરાબાદ સામેની આઈપીએલ ટી-૨૦માં ૧૨ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. હૈદરાબાદને જીતવા માટે આખરી ઓવરમાં ૧૬ રનની જરૂર હતી અને તેની ચાર વિકેટ સલામત હતી. જોકે હોલ્ડરે જબરજસ્ત દેખાવ કરતાં ટીમને સફળતા અપાવી હતી. જીતવા માટેના ૧૭૦ના ટાર્ગટ સામે હૈદરાબાદ ૮ વિકેટે ૧૫૭ રન કરી શક્યું હતું.

## ભારતીય ઓલિમ્પિક સંઘના વડા નરેન્દ્ર બત્રા સામે હોકી ફંડના દુરુપયોગ બદલ CBI તપાસ

નવી દિલ્હી

ભારતીય ઓલિમ્પિક સંઘના વડા નરેન્દ્ર બત્રા સામે હોકીના ફંડનો દુરુપયોગ કરવાની ફરિયાદને પગલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઈએ) પ્રારંભિક તપાસ શરૂ કરી છે. હોકીના ફંડના રૂપિયા ૩૫ લાખનો નરેન્દ્ર બત્રાએ અંગત ખર્ચ માટે ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે, આ પ્રકારની તપાસને આધારે પ્રથમ ડ્રાઈએ ગુનો બને છે કે નહીં તેનો નિર્ણય લેવાય છે. છેલ્લા કેટલાક સમયથી હોકી ઈન્ડિયા અને ભારતીય રમત જગતના સ્ટ્રોંગમેન નરેન્દ્ર બત્રા વચ્ચે ગજગાહ ચાલી રહ્યો છે. તાજેતરમાં ભારત ફાન્સ સામેની પ્રો હોકી લીગની મેચમાં હાર્યું તે પછી બત્રાએ ભારતીય મેન્સ હોકી ટીમના પર્ફોમન્સની ટીકા કરી હતી.

## કોરિયા ઓપન: સિંધુએ ૧૨મી વખત ઓહોરીને હરાવી, શ્રીકાંતની આગેકૂચ



સુનચિયોન

હૈદરાબાદની શટલર પીવી સિંધુ અને ક્રિદામ્બી શ્રીકાંતે કોરિયા ઓપન સુપર ૫૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું. બીજી તરફ યુવા ખેલાડી લક્ષ્ય સેન અને માલવિકા

બંસોડને બીજા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બે વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ તથા વિશ્વની સાતમી ક્રમાંકિત સિંધુએ જાપાનની આયા ઓહોરીને એકતરફી અંદાજમાં ૨૧-૧૫, ૨૧-૧૦ના સ્કોરથી પરાજય આપ્યો હતો. ઓહોરી સામે અત્યાર સુધી રમેલા તમામ ૧૨ મુકાબલામાં સિંધુએ વિજય હાંસલ કર્યા છે. તેનો આગામી મુકાબલો થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાન સામે થશે. વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડાલિસ્ટ શ્રીકાંતે ઈઝરાયેલના મિશા ઝિલ્બરમેનને ૨૧-૧૮, ૨૧-૬થી હરાવ્યો હતો.

## બાબર આઝમ ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ: કમિન્સ-બ્રાથવેઈટ પણ એવોર્ડ માટે દાવેદાર

નવી દિલ્હી

પાકિસ્તાનના સુકાની બાબર આઝમ, વેસ્ટ ઈન્ડિઝના કેગ બ્રાથવેઈટ તથા ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને માર્ચ મહિનામાં તેમણે કરેલા શાનદાર વ્યક્તિગત પ્રદર્શન માટે મેન્સ આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ થયા છે. બાબરે ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાં ૩૭૦ રન બનાવવાની સાથે વિક્રમી ૧૯૬ રનની ઈનિંગ પણ રમી હતી.

વિન્ડીઝના સુકાની બ્રાથવેઈટે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ૮૫.૨૫ની એવરેજથી ૩૪૧ રન બનાવ્યા હતા. બીજી ટેસ્ટમાં તેણે ૪૮૯ બોલનો સામનો કરીને ૧૬૦ રન બનાવી મેચને ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. મેન્સ તથા વિમેન્સ કેટેગરીમાં એક પણ ભારતીય ખેલાડી નોમિનેટ થયો નથી.

# PANCHVATI SUPERMARKET

[www.panchvatisupermarket.ca](http://www.panchvatisupermarket.ca)

OPENING SOON  
OSHAWA

## Happy Baisakhi

ચક્કી આટા, ભાલીયા આટા, ભાખરીનો લોટ, બાજરી, જુવાર, હાંડવા, ટોકળા, કણકી-કોરમા અને બીજા બધા ફ્રેશ મસાલા

મીઠાઈઓ, ગીફ્ટ બોક્સ તેમજ પૂજાની સામગ્રી મળશે તો આજે જ લાભ ઉઠાવો

MISSISSAUGA	BRAMPTON	SCARBOROUGH	ETOBICOKE	AJAX
169 Dundas St. E, Unit# 1 to 4, Mississauga, ON L5A 1W8 Call : 905-232-3955	8814 The Gore Road, Unit 4-8, Brampton, ON L6P 0B1 Call : 905-794-5372	2141 Ellesmere Road, Behind Scotia Bank Scarborough, ON M1G 3M6 Call : 416-439-9393	3-45 Woodbine Downs Blvd, Etobicoke, ON M9W 6N5 Call : 416-213-9394	18, Harwood Ave. South, Ajax, ON L1S 6N2 Call : 905 426 2499

SCARBOROUGH 1255 Markham Rd, Scarborough, ON M1H 2Z5 · Call : 416-289-6988



# રશિયન દળોએ ત્યાં કરેલા જુલ્મો, આતંકવાદી કૃત્યોથી અલગ નથી : ઝેલેન્સ્કીની હયા વરાળ

ઝેલેન્સ્કીનું સંબોધન : યુનોને વિશ્વની શાંતિ માટે તમામ આવશ્યક પગલાં ભરવા અપીલ કરવામાં આવી

યુનો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદ ઉપર પોતાની હયાજાળ ઠાલવી હતી. તેઓએ ત્યાં સુધી કહી દીધું કે જો તે રશિયા ઉપર પગલાં ન લઈ શકે તો તેમણે આ સંસ્થા જ બંધ કરી દેવી જોઈએ. ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિને કરેલાં વર્ચુઅલ સંબોધનમાં કહ્યું હતું કે, રશિયન દળોએ ત્યાં કરેલા જુલ્મો, ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ કરેલાં કૃત્યોથી અલગ નથી. તેમણે રશિયન સૈનિકો દ્વારા કરાયેલા યુદ્ધ અપરાધોની ઇસ્લામિક સ્ટેટ સાથે સરખામણી કરતાં વધુમાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રોએ કાંતો સુધારવું પડે અથવા પોતાનો વાવટો વીંટાળી દેવો પડે નહીં તો સુધારવું પડે અને રશિયાને UNSCમાં કાઢી જ મુકવું પડે. સલામતી સમીતિને કરેલાં પોતાનાં પહેલાં જ સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે રશિયન દળોના કબજામાંથી મુક્ત કરાયેલાં કીવ અને તેની પાસેનાં બુચા શહેરમાંથી કાલે પાછો આવ્યો છું ત્યાં એક પણ અપરાધ તેવો નથી રહ્યો કે જે આચરવામાં આવ્યો ન હોય. કેટલાક વિસ્તારોમાં તો કબ્જો જમાવ્યા પછી દાઈશ જેવાં સંગઠનોએ કરેલા અત્યાચારોથી ઓછા અત્યાચારો થયા ન હતા. આ કામ સલામતી સમીતીના જ એક સભ્ય દ્વારા કરવામાં આવ્યું છે કે જે એકતા અને દેશની સીમાઓને નષ્ટ કરી રહ્યો છે. અંતે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુનોએ વિશ્વની શાંતિ માટે તમામ આવશ્યક પગલાં ભરવા તાકીદે ભરવા જોઈએ.

## દળોએ રશિયાની 8 મિસાઈલ્સ તોડી પાડી : યુક્રેન



રશિયા અને યુક્રેન વચ્ચે 42 દિવસના યુદ્ધ પછી પણ લોહિયાળ જંગ શમે તેવા કોઈ સંકેત મળતા નથી. યુક્રેનના શહેરો પર રશિયા બેફામ મિસાઈલમારો કરી રહ્યું છે ત્યારે પાછલા 24 કલાક દરમિયાન યુક્રેનના દળોએ રશિયાની આઠ મિસાઈલ્સ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે. યુક્રેન એર ફોર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તમામ મિસાઈલ્સનું ટાર્ગેટ યુક્રેનના શહેરો હતાં અને આ તમામને બેલારુસમાંથી છોડવામાં આવી હતી. યુક્રેનનો આરોપ છે કે રશિયાની સેના હવે બેલારુસનો ઉપયોગ લોજિંગ પેડ તરીકે કરી રહી છે અને ત્યાંથી જ યુક્રેન પર મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. તેમનો દાવો છે કે યુક્રેનના હવાઈ ક્ષેત્રથી બચવા માટે રશિયન સેના આ ચાલ ચાલી રહી છે. દરમિયાન રશિયાએ જણાવ્યું હતું કે યુક્રેન સાથેની શાંતિ મંત્રણાઓ જે રીતે આગળ વધવી જોઈએ તે રીતે આગળ વધી રહી નથી. રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા પાસે પોતાનું શ્રેણ યુદ્ધવા માટે જરૂરી તમામ સંસાધન છે.

### USની યુક્રેનને 10 કરોડ ડોલરની લશ્કરી સહાય

અમેરિકાએ જાહેરાત કરી છે કે તેઓ યુક્રેનને 10 કરોડ ડોલરની કિંમતના વધારાના હથિયારો મોકલશે. સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકને જણાવ્યું હતું કે યુક્રેનની એન્ટિ-આર્મ્સ સિસ્ટમ્સ માટેની તાકીદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 10 કરોડ ડોલરની કિંમતના વધારાના હથિયારો યુક્રેન મોકલવા મેં મંજૂરી આપી દીધી છે.

### ભારત જાઓ પરંતુ યુરોપિયન દેશોમાં નહીં : રશિયાની લોકીને એડવાઈઝરી

યુદ્ધના પગલે રશિયાએ પોતાના દેશના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં યુરોપિયન દેશોમાં નહીં જવા જણાવીને ભારત જવા માટે સલાહ આપી છે. ભારત ઉપરાંત યુએઈ જવાની પણ છુટ આપવામાં આવી છે. પર્યટન વિકાસ રાજ્ય ડયૂમા સમિતિના ઉપાધ્યક્ષ નતાલિયા કોસ્ટેકોએ વર્તમાન સંજોગોમાં યુરોપીય દેશોનો પ્રવાસ કરવો રશિયાના નાગરિકો માટે જોખમી છે. કારણ કે યુરોપના ઘણા દેશોમાં મોટી સંખ્યામાં યુક્રેનિયન રહે છે. ભારત, યુએઈ ઉપરાંત તુર્કી, ઘર્રાચાયલ અને શ્રીલંકા જેવા દેશોને યુરોપ કરતા વધુ સુરક્ષિત ગણાવ્યા છે.

### મારિયુપોલમાં રશિયાના હુમલા ચાલુ છે : બ્રિટન

બ્રિટિશ મિલિટરી ઇન્ટેલિજન્સે બુધવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન શહેર મારિયુપોલમાં રશિયાના હવાઈ હુમલા અને ભારે લડાઈ હજુ પણ ચાલુ જ છે. આ શહેરની પરિસ્થિતિ સતત કથળી રહી છે તેમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. શહેરમાં હાલમાં 1.60 લાખ લોકો રહી ગયા છે જેમના માટે વીજળી નથી.

**MOTEL  
for  
SALE**

**NIRAJ PANCHOLI, REALTOR®**

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.com

Website: https://niraj-pancholi.c21.ca/

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience  
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...  
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011  
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings



**MOTEL KING: Specializing in Selling Motels: LIST & SELL with confidence**

Major Achievements: Among TOP 75 PRODUCERS IN CANADA AWARD & CENTURION PRODUCER AWARDS 2017-2021

**New: 30+ Room Motel in Sault Ste Marie City**

With 3 BR house, main street of downtown, minutes away form all amenities such as shopping malls, schools, college, airport. Close to USA border. - Asking Price: \$1.7M

**URGENT LISTINGS REQUIRED MOTELS & HOTELS**

MANY Qualified Buyers are Ready to sign the OFFER and CLOSE the Deal in 1 to 3 months. Closing in 3 Weeks if the Seller willing to Hold a Mortgage. Call me ASAP if interested to SELL quickly.

**New: Franchise Hotel near Ottawa Airport**

60+ Room, full-service hotel, Asking under \$8M

**12 to 45 Room Motels Northern Ontario**

Asking Price: \$1,300,000 To \$5,000,000  
(40% to 50% down payment require)

**MOTEL OPERATOR REQUIRED FOR NORTHERN ONTARIO**

Good pay & free accommodation, family preferred  
Partnership OR Revenue Bonus for the right candidate

**Recently SOLD Motels Near**

Welland, London, Sarnia, North Bay, Cochrane, Sudbury,  
Pembroke, Ottawa, Thunder Bay

**JOB AVAILABLE : For the Motel located in Northern Ontario**

- **Housekeeper** for room cleaning and general work in the motel, accommodation available for the couple / small family
- **Working Partner** Willing to invest min \$200K, stay & operate/manage the motel offering Partnership + Salary to operate







**Lapoto Finish**

पोर्सेलिन  
टाइल्स शुरु थाय  
छे इन्क  
\$ 0.89 થી

**Porcelain tiles starting from  
\$0.89 per square  
feet only**

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking



**Matt Finish**

સિરામિક  
ટાઈલ્સ શરુ  
થાય છે  
\$ 0.50 થી

**Ceramic tiles starting from  
\$0.50 per square  
feet only**

- ◆ પોર્સેલિન ટાઈલ્સ અને સિરામિક ટાઈલ્સ ફેક્ટરી ભાવે મળશે
- ◆ અમારા ભાવની ખાત્રી કરી શકો છો. વધારાના ૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે
- ◆ ફ્લોર, દિવાલ અને આઉટડોર પાર્કિંગની ટાઈલ્સ મળશે

**:- Available Size :-**

**24" \* 24" | 12" \* 24" | 24" \* 48" | 4" \* 8" | 4" \* 12"**

**MONTREAL**

3590, Rue Griffith, Saint Laurent, QC, H4T 1A7  
Phone: +1-514-260-2242 /  
+1-514-813-3850


**OTTAWA**


Unit #4+5, 200 Colonnade Road,  
Nepean, ON, K2E 7M1  
+1-613-601-1474

**MISSISSAUGA**

5030 Maingate Drive, Unit#1, Mississauga, L4W 1X5  
Phone: +1 (647) 527-6030 /  
+1-514-813-3850

<https://clubceramic.com> Email : [sales@clubceramic.com](mailto:sales@clubceramic.com)






**Chapel  
Ridge**

FUNERAL HOME  
& CREMATION CENTRE

**416.993.0826**  
**24/7 # 905.305.8508**



તમારી સગવડ માટે અમે બે ફ્યુનરલ સેન્ટર ઓફર કરીએ છીએ. મારખમ અને મિસિસાગા. સંપૂર્ણ હિન્દુ તથા જૈન વિધિની સગવડતા. (St. John's Dixie, 737 Dundas St. E., Mississauga, ON L4Y 2B5)

ફ્યુનરલ સર્વિસ, બેઝિક કાસ્કેટ, ક્રિમેશન અને ટેક્સ બધાં સાથે ટોટલ ફક્ત  
**\$4270**

વધુ માહિતી માટે ફોન કરો. અમારો પ્રોફેશનલ સ્ટાફ તમારી ભાષામાં તમને માહિતી આપશે.  
**પ્રિપેઇડ ફ્યુનરલ અને ટ્રાવેલ ઈન્સુરન્સ**

1. તમારા ડોલર ફ્યુનરલ હોમમાં જમા નહિ થાય. પરંતુ સરકારે નીમેલી ટ્રસ્ટ કંપની પાસે રહેશે.
2. એક વખત પ્લાન ખરીદ્યા પછી તમે કે તમારા ફેમિલીએ કદી પણ વધુ પૈસા નહિ આપવા પડે.
3. ટ્રાવેલ ઈન્સુરન્સ - ફક્ત **\$595** એક વખત આપી જિંદગી ભર તમે ક્યાંય પણ નિશ્ચિત ટ્રાવેલ કરી શકશો. \*

\* This is not a general insurance. Applies only in case of a death away from home.

8911 Woodbine Avenue, Markham, Ontario L3R 5G1  
[www.chapelridgefh.com](http://www.chapelridgefh.com) • [info@chapelridgefh.com](mailto:info@chapelridgefh.com)